

Amul to launch organic products, set up haats and 'green college'



Entering the nascent Rs 2,000-crore organic food segment in India, Amul will soon launch organic "aata", rice, honey, chocolates and potato products, said RS Sodhi, managing director of Gujarat Cooperative Milk Marketing Federation (GMMF).

It also plans to set up a "green college" at Anand to spread awareness about organic and natural farming among young generation of farmers, along with "organic haats" across Gujarat to market and sell organic products. "We are also designing a logo for these

organic products. It will be made public soon," Sodhi told The Indian Express on the sidelines of a "chintan shibir" — a two-day brainstorming session for state government officials, organised by Gujarat government's co-operation department at Sardar Patel Institute of Public Administration (SPIPA) in Ahmedabad on Wednesday.

According to Sodhi, Amul is designing testing, distribution and marketing infrastructure for both organic and natural farming products. GMMF is also looking to set a laboratory that will test and certify organic products.

"Testing is big for us. If we offer a product under the Amul brand, we want it to be properly tested and authenticated. Though costly, we are planning to set up a laboratory to test and certify organic products that we plan to source from farmers who are part of our district unions," Sodhi added.

Amul's move to enter the organic food marketing segment comes after Union Co-operation Minister Amit Shah during his visit to Anand in November 2021 urged the dairy behemoth to lead an initiative to create testing, distribution and marketing infrastructure for organic products in the country.

Differentiating organic farming and natural farming, Sodhi said both methods were free of chemical fertilisers. "Organic farming has an higher input cost in the form of bio fertilisers, etc., while natural farming has almost no input cost. Except this difference, both the methods are the same," he added.

The green college in Anand will be set up by Amul, in association with Tribhuvandas Foundation — a charitable trust founded by Tribhuvandas Patel, the founder chairman of Amul. "We are designing courses about organic and natural farming that will be offered at this college. It will also include demonstration projects and later when they finish their training, we will link them with the markets," he added.

At the chintan shibir, Jagdish Vishwakarma, state minister for cooperation (underpinned charge), Raghuvi Patel, cabinet minister for agriculture and animal husbandry, Jitu Chaudhari, minister of state for fisheries and Mukesh Patel, minister of state for agriculture, were present.

"Organic food is considered elite. It is bought by urban working couples who belong to higher income groups and are health conscious. The common man

in India does not buy organic. It is currently a fad. The aim of Amul is to democratise organic food and make it available for the common man. We want to people to trust our products," Sodhi said.

He added that Amul will set up "organic haats" where producers can sell directly to consumers across Gujarat and will also provide an e-commerce platform to existing organic players.

Organic farming is done in over 2.6 lakh acres in India, Sodhi said adding, Madhya Pradesh and Maharashtra account for 40 per cent and 22 per cent respectively of the area under organic farming, while Gujarat has just three per cent.

"The market of organic products in India is worth Rs 23,000 crore, of which the market for organic food is just Rs 2,000 crore, while products worth Rs 7,000 crore are exported. Most of it is soybean extracts worth Rs 4,000 crore," he added.

Vadodara POCSO court awards 'life imprisonment unto death' to two men

Vadodara : A special court for Protection of Children against Sexual Offences (POCSO) cases in Vadodara on Wednesday sentenced two men to life imprisonment unto death for the gangrape of a 15-year-old girl in the Navakhai ground in November 2019.

The accused, in their 20s, were convicted under Section 6 (1) of the POCSO Act, which provides for imprisonment of a term not less than 20 years up to a death sentence. Special POCSO judge RT Panchal awarded life imprisonment to them for the remainder of their natural life, considering the "gravity of the case" and to set an example to deter other persons from committing a similar offence.

The Vadodara Detection of Crime Branch (DCB) had filed a 1,500-page chargesheet in the case in the special POCSO court in Vadodara in January 2020, within 45 days of the incident. Investigating officer Assistant Commissioner of Police DS Chauhan of the Vadodara

Crime Branch added section 6(1) of the POCSO Act while filing the chargesheet, which makes the offence punishable with a minimum sentence of 20 years, upto a death penalty.

Indian Penal Code section 394 (causing hurt to commit robbery) was also added during the filing of the chargesheet, in addition to IPC sections 325 for causing grievous hurt, 363 for kidnapping, 376(2)(n) for repeated rape of the same woman, 376(D) for gangrape and 377 for unnatural sexual offence, as well as relevant sections of the Gujarat POCSO Act.

A total of 40 witnesses were examined in the case in addition to the deposition of the victim and her friend. The legal service department of the state also appointed advocate Pravin Thakkar as special public prosecutor.

Thakkar said, "We welcome the judgement... All evidence was in favour of the prosecution, including circumstantial, medical,

technical and material evidence... The accounts of witnesses as well as the victim played a key role; we did not have a single witness turning hostile. The police's hard work has paid off. I sought capital punishment for the accused but the court, after examining the evidence, deemed it fit to sentence them to imprisonment for life unto death."

The incident took place on the night of November 28, 2019, when the girl had gone for a stroll with her friend after visiting a religious place near the ground. The two accused accosted the girl and assaulted her friend before dragging her for over 800 metres on the stony path into the thickets where she was gagged and raped.

Police used drone cameras to study the terrain and identify routes that could have helped the accused exit the crime scene. The Ahmedabad Crime Branch later joined the probe and the accused were nabbed on December 8.

Pakistan apprehends 60 Gujarati fishermen



Ahmedabad : The Pakistani Maritime Security Agency has apprehended 9-10 Indian fishing boats and captured 50-60 fishermen from Gujarat from the international maritime border, sources said on Wednesday.

"Fishermen who are at sea informed us that Pakistan on Tuesday seized 9-10 of our boats and taken 50-60 of fishermen captive near the international maritime boundary. These fishermen who set sail eight days ago are from Porbandar, Okha and Mangrol. The exact number of fishermen will be known once

they land in Pakistan," Manish Lodhari, an activist and head of Porbandar based Marine Fisheries Cooperative Society.

This is second such incident within a week. Couple of days ago, two Indian boats and 13 fishermen from Gujarat were captured by PMSA from the high-seas near the maritime border.

When asked if the fishing boats were not fitted with GPS devices, Lodhari said, "Yes they do. But sometimes, the fishermen while fishing too close to the boundary, accidentally cross over."

Miscreants deface Gandhi statue in Kutch

Ahmedabad : Unknown miscreants defaced a statue of Mahatma Gandhi in the Hamirsar Talav area of Bhuj town on Wednesday. Officials said that the municipal staff found a black cap on the statue's head and the word, Papa, scribbled on the statue with black ink. A senior police official said that an FIR will be lodged in the matter soon and CCTV footage is being scanned to ascertain the identity of the miscreants. Ghanishyam Thacker, the president of Bhuj Municipality, said, "The municipal staff informed me about the incident around 10:30 am."

28 booked for 'pelting stones' at wedding procession of Dalit man



Ahmedabad : As many as 28 persons from Mota village in Palanpur of Banaskantha including its sarpanch were booked for allegedly threatening a Dalit groom to not ride a horse during his wedding procession and pelting stones at the procession Monday.

According to a police complaint by Virabhai Sekhaliya, father of the groom, Atul Sekhaliya, his family was warned by a group of villagers including the sarpanch of dire consequences if the groom happened to ride a horse.


Consequently, the groom did not ride a horse during his marriage on Monday, however, 3-4 stones were pelted on the procession

by a group of accused men as the persons in the procession were wearing "safas" (traditional head gear), said the police. "On February 2, my nephew Suresh submitted an application to the police asking police protection for my son to ride a horse during his wedding procession. After our application was sent to the police, the sarpanch of the village Bharat Singh Rajput along with two other accused warned us that my son cannot ride a horse in his wedding procession," said Virabhai in his complaint.

Police lodged an FIR at Gadhi police station against 28 persons including Bharat Singh Rajput under sections of the SC/ST Prevention of Atrocities Act and relevant sections of the IPC.

DSP Kushal Oza said, "A minor stone pelting incident was reported from the village. We have booked 28 accused and arrested one for stopping the groom for riding the horse. Four teams have been made for investigation."

Process to recruit forest guards to resume soon, says minister



Ahmedabad : The Gujarat government Wednesday announced to resume the recruitment process for 334 vacancies of forest guard in the forest department soon. The recruitment was put on hold in 2018. Making the announcement, Forest & Environment Minister Kirtisinh Rana said that the recruitment that was put on hold due to unavoidable circumstances will be resumed soon "in the interest of the youths of Gujarat". Rana added that the applicants whose applications were validated in 2018 will be able to appear for the exam irrespective of their current age.

According to Rana, the candidates who filed applications under Open

Competition category in 2018

Reliance Jewels celebrates the special Valentine collection 'Floreo'

Ahmedabad, Reliance Jewels, India's leading jewellery brand, has launched "Floreo" — a special Valentine's

day collection for those who help love grow. With the concept of love growing and becoming stronger with time, Reliance Jewels embraces the season of love with the launch of this exquisite diamond jewellery collection with minimalist and modern designs to celebrate Valentine's Day. Commenting about the new collection, Sunil Nayak, CEO of Reliance Jewels said, "This season of love, we want to imbibe and share the true meaning of love with our

valued customers through our newest collection 'Floreo'. Our aim has always been to bring out the best in our customers.

With these designs inspired by the philosophy "Grow in Love", we hope to inspire the world to love one another and grow together, building stronger bonds." The design in the collection are inspired by plants and flowers that grow so gracefully day after day. Just as a newly planted seed turns into a beautiful plant, it is the brewing love story that blooms into a beautiful relationship. All good things see the light of growth with time. (13-9)



PRAVEG COMMUNICATIONS (INDIA) LIMITED				
(Formerly Sword and Shield Pharma Limited in which Praveg Communications Limited has amalgamated)				
Regd. Office: 214, Athena Avenue, Behind Jaguar Showroom, S.G. Highway, Gota, Ahmedabad - 382481				
Phone: +91 79 27496737 Website: www.praveg.com E-mail: cs@praveg.com				
Extract of Unaudited Consolidated Financial Results for the quarter and nine months ended December 31, 2021				
(Rs. in lakhs, except per share data)				
Particulars	Quarter ended 31/12/2021	Nine months ended 31/12/2021	Quarter ended 31/12/2020	31/12/2020
Revenue from Operations	1582.26	2836.78	1797.71	1797.71
Profit before exceptional items and tax	730.69	1008.70	680.85	680.85
Profit before tax	730.69	1008.70	680.85	680.85
Profit for the period	547.58	755.54	509.41	509.41
Total Comprehensive Income (after tax)	547.58	755.54	509.41	509.41
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41	1848.41	1848.41	1848.41
Other Equity excluding revaluation reserve	-	-	-	-
Earnings per equity share (face value of Rs. 10 each)	-	-	-	-
Basic (Not Annualised)	2.96	4.09	2.76	2.76
Diluted (Not Annualised)	2.96	4.09	2.76	2.76

Note: 1. The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results at their respective meetings held on February 10, 2022. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.
2. Additional information on Unaudited Standalone Financial Results is as follows:

(Rs. in lakhs, except per share data)				
Particulars	Quarter ended 31/12/2021	Nine months ended 31/12/2021	Quarter ended 31/12/2020	31/12/2020
Revenue from Operations	1574.88	2829.40	1797.71	1797.71
Profit before exceptional items and tax	729.71	1007.90	680.89	680.89
Profit before tax	729.71	1007.90	680.89	680.89
Profit for the period	546.60	754.74	509.45	509.45
Total Comprehensive Income (after tax)	546.60	754.74	509.45	509.45
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41	1848.41	1848.41	1848.41
Other Equity excluding revaluation reserve	-	-	-	-
Earnings per equity share (face value of Rs. 10 each)	-	-	-	-
Basic (Not Annualised)	2.96	4.08	2.76	2.76
Diluted (Not Annualised)	2.96	4.08	2.76	2.76

3. The above is an extract of the detailed format of the standalone and consolidated financial results for the quarter and nine-months ended December 31, 2021 filed with the Stock Exchange pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.
4. The full format of the standalone and consolidated financial results for the quarter and nine-months ended December 31, 2021 are available on the Stock Exchange's website (www.bseindia.com) and the Company's website www.praveg.com.

For Praveg Communications (India) Limited
Sd/-
Vishnukumar Patel
Chairman

Place: Ahmedabad
Date : February 10, 2022

VIVANTA INDUSTRIES LIMITED
Regd. Office: 403/TF, Sarthik II, Opp. Rajpath Club, S. G. Highway, Bodakdev, Ahmedabad-380054, Gujarat, India. Phone: 079-26870952
email: business@vivantaindustries.com, web: www.vivantaindustries.com

CIN: L74110GJ2013PLC075393

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED DECEMBER 31, 2021

(Rs. in lacs except per share data)

SR. NO.	Particulars	Quarter Ended		Nine Month Ended		Year ended 31/03/2021 (Audited)
		31/12/2021 (Unaudited)	30/09/2021 (Unaudited)	31/12/2020 (Unaudited)	31/12/2020 (Unaudited)	
1.	Total Income from Operations	53.02	36.27	0.00	93.78	54.52
2.	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary item)	(4.58)	13.25	(14.33)	(2.57)	(16.37)
3.	Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary item)	(4.58)	28.34	4.06	57.52	0.82
4.	Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordinary item)	(4.58)	28.34	4.06	57.52	0.82
5.	Total Comprehensive Income for the period (Comprising profit for the period (after tax) and other comprehensive income (after tax))	(4.58)	28.34	4.06	57.52	0.82
6.	Equity Share Capital	1000	1000	1000	1000	1000
7.	Earnings Per Share (of Rs. 10/- each) for continuing and discontinued operations	(0.05)	0.28	0.04	0.58	0.01
1. Basic		(0.05)	0.28	0.04	0.58	0.01
2. Diluted		(0.05)	0.28	0.04	0.58	0.01

Note: 1. The results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on February 10, 2022. The results have been subjected to limited review by the Statutory Auditors of the Company.
2. Information on Standalone Financial Results are as follows:

Particulars	Quarter Ended		Nine Month Ended		Year ended 31/03/2021 (Audited)
	31/12/2021 (Unaudited)	30/09/2021 (Unaudited)	31/12/2020 (Unaudited)	31/12/2020 (Unaudited)	
Total Income (continuing operation)	52.96	29.61	0.00	87.06	54.52
Profit / (Loss) before tax from continuing operation	0.94	35.13	8.77	72.82	3.47
Profit / (Loss) after tax from continuing operation	0.94	35.13	8.77	72.82	3.47
Profit / (Loss) before tax from discontinued operation	-	-	-	-	-
Profit / (Loss) after tax from discontinued operation	-	-	-	-	-

3. The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results are available on the websites of the Stock Exchange (www.bseindia.com) and on the Company's website (www.vivantaindustries.com).

For, Vivanta Industries Limited
Sd/-
KULDIP PAREKH
CFO
PAN : BFDPP4709

Place: Ahmedabad
Date: 10-02-2022

અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કર્યું



जोनस ओडीस-ओली मेकर्स बेम्बर् २, हवे भाषे, विनय के शाह भाई, नतीमान
पोस्ट, मुम्बई-२१सी.नं. ४४५०३९८९, ८२, ८३ केस २२६४९८७९
ईमेल-westernzone@csb.co.in

[illegible]

અરજદાર કંપનીના વતિ અને માટે
બી.એમ.જે.કેબલ્સ લિમિટેડ
મહેન્દ્ર રાજપુરોહિત
ડિરેક્ટર (ડીઆઈએન : ૦૦૦૪૨૫૪૩)

કરતાં ગળે ડૂબો બાઝી ગયો. .
 શહેરમાં બીજી જગ્યાઓએ પણ
 બહામ્બારદર થયા હતા અને પછી
 લોકોને એમ્બ્યુલન્સમાં સિવિલ લવાઈ
 હતા હતા ત્યાં ત્યાં દુષ્કર્મના બંને
 દર્શાવને ટ્રોમા સેન્ટર પાસેના ઝોન
 પાસે ઊભા રાખી થાયશ ડઈઝોની
 મદદ કરવા પહોંચ્યા હતા, એટલામાં
 ત્યાં પણ બ્લાસ્ટ થયો હતો. માતા
 સિવિલ પહોંચી ત્યારે ટ્રોમા સેન્ટરમાં
 એટલી થી પહોંચી કે પતિ અને
 રોહનનો કલાકો અહીં કોઈ પતે મળ્યો
 નહોતો. કલાકથી વધુ સમય થઈ ગયો
 પછી યશ મળ્યો, તેના શરીરના માગે
 પછાત ઈજા થયેલી હતા. રાતે પાતન

[illegible]

ઈ-ટેન્ડર બંધ થવાની તારીખ અને સમય : 08.03.2022ના 15.00 કલાકે. કાપાલાયનું સરનામુ : ડિવિઝનલ રેલવે મેનેજર (વર્ક/એક્ઝીક્યુટિવ) એન્જીનિયરિંગ વિભાગ, ઝાલોડ રોડ, ડી.એન.એમ. ઓફિસ, જુહાપુરા કન્ટન સોસાયટી ડોરિયપલની સમીપ, અસલાવા, નરીડો રોડ, અમુકુધુરા, પોસ્ટ ઓફિસ : સૈયુધાનિયન, અમરકાંત, ગુજરાત - 392345. ઈ-ટેન્ડરના માધ્યમથી એવર યેલો ટાગ બેલોગ્રાફિંગ : www.mca.gov.in

(Formerly Sword and Shield Pharma Limited in which Praveg Communications Limited has amalgamated)

PRAVEG Regd. Office: 214, Athena Avenue, Behind Jaguar Showroom, S.G. Highway, Gota, Ahmedabad - 38248
Phone: +91 79 27406737 | Website: www.praveg.com | E-mail: cs@praveg.com

Extract of Unaudited Consolidated Financial Results for the quarter and

Extract of unaudited consolidated financial results for the quarter and nine months ended December 31, 2021 (Rs. in lakhs, except per share data)

Particulars	Quarter ended		Nine months ended		Quarter ended	
	31/12/2021		31/12/2021		31/12/2020	
Revenue from Operations	1582.26		2836.78		1797.19	
Profit before exceptional items and tax	730.69		1008.70		680.80	
Profit before tax	730.69		1008.70		680.80	
Profit for the period	547.58		755.54		509.45	
Total Comprehensive Income (after tax)	547.58		755.54		509.45	
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41		1848.41		1848.41	
Other Equity excluding revaluation reserve	-		-		-	
Earnings per equity share (Face value of Rs. 10 each)	-		-		-	
Basic (Not Annualised)	2.96		4.09		2.74	
Diluted (Not Annualised)	2.96		4.09		2.74	

Note:

1 The Audit Committee has reviewed the above results and the Board of Directors has approved the above results at their respective meetings held on February 10, 2022. The Statutory Auditors of the Company have carried out a Limited Review of the aforesaid results.

2 Additional information on Unaudited Standalone Financial Results is as follows:

Particulars	(Rs. in lakhs, except per share data)			
	Quarter ended 31/12/2021	Three months ended 31/12/2021	Quarter ended 31/12/2020	Quarter ended 31/12/2020
Revenue from Operations	1574.88	2829.40	1377.97	2608.80
Profit before exceptional items and tax	729.71	1007.90	680.80	1007.90
Profit before tax	729.71	1007.90	680.80	1007.90
Profit for the period	546.60	754.74	509.48	754.74
Total Comprehensive Income (after tax)	546.60	754.74	509.48	754.74
Paid up Equity Share Capital (of Rs. 10 each)	1848.41	1848.41	1848.41	1848.41
Other Equity excluding revaluation reserve	-	-	-	-
Earnings per equity share (face value of Rs. 10 each)	-	-	-	-
Basic (Net Annualised)	2.96	4.08	2.71	4.08
Diluted (Not Annualised)	2.96	4.08	2.71	4.08

3 The above is an extract of the detailed format of the standalone and consolidated financial results for the quarter and nine-months ended December 31, 2021 filed with the Stock Exchange pursuant to Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015.

4 The full format of the standalone and consolidated financial results for the quarter and nine-months ended December 31, 2021 are available on the Stock Exchange's website (www.bseindia.com) and the Company's website www.praveg.com.

For Praveq Communications (India) Limited

Place: Ahmedabad
Date : February 10, 2022

મહેસાણા, કડી તાલુકાના ૩ તોલા સોનાનું મંગલસૂત્ર અને મામલે કડી પોલીસે અજાણ્યા શખ્સ સામે
નાનીકડીની સોમ વિદ્યાવપના કેમ્પસમાં મોઝાઈલ સહિત રૂ. ૧.૬૬ લાખની ગુનો નોંધી સીસીટીવી ચેક કરવલ્યો
યોગ્યેલા એક લગ્ન પ્રસંગમાંથી ગંઠિયો મત્તા રાખેલું પર્સ ઉઠાવી ગયો હતો. આ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

**SUNGOLD CAPITAL LTD**

[CIN: L65910G]1993PLC018956]

Regd off: House no. 7/13, opp White Tower, Station Road, Nandod, Rajpipla Narmada - 393145.
Corporate Off: B/618, 6th Floor, Jaswanti allied Business Centre, off: Ramchandra Lane extn,
Malad (west) Mumbai - 400064

Website: www.sungoldcapitallimited.com | Email: info@sungoldcapitallimited.com

STATEMENT OF UNAUDITED FINANCIAL RESULT FOR THE QUARTER AND NINE MONTH

ENDED DECEMBER 31, 2021				(Rs. In Lakhs, except per share data)
Sr. no.	Particulars	Quarter ended	Nine Months ended	Corresponding Three months ended in the previous year
		31-12-2021 Unaudited	31-12-2021 Unaudited	31-12-2020 Unaudited
1	Total Income from Operations	32,484	105,747	39,062
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary Items)	3,077	9,710	2,501
3	Net Profit / (Loss) for the period before Tax (after Exceptional and/or Extraordinary Items)	3,077	9,710	2,501
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary Items)	2,085	7,889	1,783
5	Total Comprehensive Income for the period (Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	2,085	7,889	1,783
6	Equity Share Capital (Face value of Rs. 10/-)	1840,350	1840,350	1840,350
7	Reserves (excluding Revoluton Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-	-	-
8	Earnings Per Share (of Rs. 10/- each) (for continuing and discontinued operations)			
(a)	Basic	0.011	0.043	0.010
(b)	Diluted	0.011	0.043	0.010

NOTES:
The above result is reviewed by the Audit Committee at the meeting and approved by the Board of Directors at their meeting held on Thursday, February 10, 2022. The above is an extract of the detailed format of financial result filed with Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Disclosure Requirements), Regulations, 2015. The full format of Financial Result is available on Stock Exchange website www.bseindia.com and on Company's website, www.sungoldcapitalimited.com
The Company has three profitable segments which are NIREC Entertainment and software development

The Company has three reportable segments which are: (i) NDC, (ii) Entertainment and (iii) Software Development.

Place: Mumbai
Date: 10-02-2022

For Sungold Capital Limited
Sd/-
Rajiv Kotia
(Chairman & Managing Director)
DIN: 00135912

Date: 10-02-2022 DIN: 00155912

VIVANTA INDUSTRIES LIMITED

Regd. Office: 403/TF, Sarthik II, Opp. Rajpath Club, S. G. Highway,
Bodakdev, Ahmedabad-380054, Gujarat, India. Phone: 079-26870952
email: business@vivantaindustries.com web: www.vivantaindustries.com

CIN: L74110GJ2013PLC075393

EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULT

NINE MONTHS ENDED DECEMBER 31, 2021
(Rs. In lacs except per share data)

SR. NO.	Particulars	Quarter Ended			Nine Month Ended		Year ended 31/03/2021 (Audited)
		31/12/2021 (Unaudited)	30/09/2021 (Unaudited)	31/12/2020 (Unaudited)	31/12/2021 (Unaudited)	31/12/2020 (Unaudited)	
1.	Total Income from Operations	53.02	36.27	0.00	93.78	36.13	54.52
2.	Net Profit for the period (before Tax, Exceptional and/or Extraordinary y item)	(4.58)	13.25	(14.33)	(2.57)	(17.58)	(16.37)
3.	Net Profit for the period before Tax (after Exceptional and/or Extraordinary y item)	(4.58)	28.34	4.06	57.52	0.82	(16.37)
4.	Net Profit for the period after Tax (after Exceptional and/or Extraordinary y item)	(4.58)	28.34	4.06	57.52	0.82	(17.52)
5.	Total Comprehensive Income for the period [Comprising profit for the period (after tax) and other comprehensive Income (after tax)]	(4.58)	28.34	4.06	57.52	0.82	(17.52)
6.	Equity Share	1000	1000	1000	1000	1000	1000

	Capital						
7	Earnings Per						

Share (of Rs.10/- each)(for continuing and discontinued operations)	10.00	0.00	0.00	0.00	0.00	0.00
---	-------	------	------	------	------	------

1. Basic	(0.05)	0.28	0.04	0.58	0.01	-0.18
2. Diluted	(0.05)	0.28	0.04	0.58	0.01	-0.18

1. The results were reviewed by the Audit Committee and approved by the Board of Directors at their meetings held on February 10, 2022. The results have been subjected to limited review by the Statutory Auditors of the Company.

2. Information on Standalone Financial Results are as follows:

	Quarter Ended			Nine Month Ended		Year ended
Particulars	31/12/2021 (Unaudited)	30/09/2021 (Unaudited)	31/12/2020 (Unaudited)	31/12/2021 (Unaudited)	31/12/2020 (Unaudited)	31/03/2021 (Audited)
Total Income (continuing operation)	52.96	29.61	0.00	87.06	36.13	54.52
Profit (Loss)	0.94	35.13	8.77	72.82	13.78	3.47

before tax						
------------	--	--	--	--	--	--

from continuing operation						
Profit / (Loss)	0.94	25.12	9.77	72.92	12.79	2.22

Profit / (Loss) after tax from continuing operation	0.34	39.13	0.77	72.62	19.70	2.92
Profit / (Loss) before tax from discontinued operation	-	-	-	-	-	-
Profit / (Loss) after tax from discontinued	-	-	-	-	-	-

3. The above is an extract of the detailed format of the Standalone and Consolidated Financial Results filed with the Stock Exchange under Regulation 33 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015. The full format of the Standalone and Consolidated Financial Results are available on the websites of the

StockExchange (www.bseindia.com) and on the Company's website (www.vivantaindustries.com)

Place: Ahmedabad
Date: 10-02-2022

For, Vivanta Industries Limited
SD/-
KULDIP PAREKH
CFO
PAN : BFDPP4709